

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટનની સંસ્થાઓ મફત (કોમ્પ્લિમેન્ટરી) રિક હેન્સેન ફાઉન્ડેશન એક્સેસિબિલિટી સર્ટિફિકેશન રેટિંગ મેળવવા અરજી કરી શકે છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (માર્ચ 11, 2020) – ઓન્ટેરિયોમાં દસમાંની એક મ્યુનિસિપાલિટી તરીકે બ્રેમ્પટનને પસંદ કરવામાં આવ્યું છે જ્યાં સ્થાનિક સંસ્થાઓ એક મફત (કોમ્પ્લિમેન્ટરી) રિક હેન્સેન ફાઉન્ડેશન એક્સેસિબિલિટી સર્ટિફિકેશન (RHFA) મેળવવા અરજી કરવાને પાત્ર બને છે, આ કાર્યક્રમ અશક્તતા ધરાવતા લોકો માટે ઇમારતો કેટલી સુલભ (પ્રવેશયોગ્ય) છે તેનું રેટિંગ કરે છે.

સમગ્ર શહેરની નફો ન રળનારી, જાહેર અને ખાનગી સંસ્થાઓને મફત RHFA રેટિંગનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી તેઓ પોતાની ઇમારતોનું સુલભતા (પ્રવેશયોગ્ય) સ્તર વધારે સારી રીતે સમજી શકે અને સુધારાઓ કરવાની રીતભાતો ઓળખી શકે. ઉચ્ચ કક્ષાનું પૂરતું રેટિંગ મેળવતી ઇમારતો રિક હેન્સેન ફાઉન્ડેશન એક્સેસિબિલિટી સર્ટિફાઇડ અથવા એક્સેસિબિલિટી સર્ટિફાઇડ ગોલ્ડ બનશે.

નવા કોમ્પ્લિમેન્ટરી RHFA કાર્યક્રમને ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોની સાથે રિક હેન્સેન ફાઉન્ડેશનની ભાગીદારીમાં સમુદાયો માટે વધારે સુલભ બનાવવાના લક્ષ્ય સાથે ભંડોળ આપવામાં આવે છે. બ્રેમ્પટનને પોતાની વસ્તીના કદ અને ભૌગોલિક વિવિધતા માટે પસંદ કરવામાં આવ્યું હતું. સમગ્ર બ્રેમ્પટનમાં આશરે 25 સ્થળો કોમ્પ્લિમેન્ટરી RHFA રેટિંગ મેળવવાને પાત્ર બનશે. સંસ્થાઓએ માર્ચ 27 સુધીમાં અરજી અહીં અવશ્ય કરવી રહી, www.rickhansen.com/freerating.

RHFA કાર્યક્રમ પર વધુ માહિતી મેળવવા વેબસાઇટ જુઓ, www.brampton.ca

ઝાંખીઓ

- RHFA કાર્યક્રમ મારફતે રેટિંગ મેળવતી સંસ્થાઓ પોતાના સ્થળ માટે સ્કોરકાર્ડ રેટિંગ અને સફળતા અને સુધારાના મહત્વના ક્ષેત્રોનો અહેવાલ મેળવશે.
- ઓસીટી ઓફ બ્રેમ્પટનની નાગરિક સભ્યોની બનેલી એક્સેસિબિલિટી કમિટી RHFA કાર્યક્રમમાં બધી અરજીઓની સમીક્ષા મે મહિનાના અંત/જૂનની શરૂઆત સુધીમાં કરશે. અરજદારોને જુલાઈ 3, 2020 સુધીમાં જાણ કરવામાં આવશે જો તેઓની અરજી સફળ રહે.
- સીટી ઓફ બ્રેમ્પટન અને તેની [એક્સેસિબિલિટી એડવાઈઝરી કમિટી](#) તમામ ઉંમરના અને ક્ષમતાઓ ધરાવતા લોકો પોતે બ્રેમ્પટનમાં રહે, કામ કરે, રમતો રમે, મુલાકાત લે અને રોકાણ કરે ત્યારે તેઓને સરખી તકો મળી રહે તેની ખાતરી કરાવવા કટિબદ્ધ છે.

અવતરણો (ક્વોટ્સ)

“બ્રેમ્પટન એક મોજેઈક છે અને સીટીમાં અશક્તતા ધરાવતા લોકો માટે અવરોધો હટાવવા અને આપણાં સમગ્ર વૈવિધ્ય સમુદાયમાં સુલભતા (એક્સેસિબિલિટી) વધારવા તકો ઓળખી કાઢવા અમે કટિબદ્ધ છીએ. હું રોમાંચિત છું કે બ્રેમ્પટનની પસંદગી RHFA કાર્યક્રમમાં ભાગ લેવા થઈ હતી, અને સ્થાનિક સંસ્થાઓને સહભાગી થવા અને આપણાં શહેરને સૌ માટે વધારે સુલભ (પ્રવેશયોગ્ય) બનાવવામાં અમને મદદરૂપ થવા પ્રોત્સાહિત કરું છું.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“એક્સેસિબિલિટી એડવાઈઝરી કમિટીમાં કાઉન્સિલના પ્રતિનિધિ તરીકે, અમે સમુદાય સાથે મળીને કરી રહ્યાં છીએ તે કામનું મને ગૌરવ છે જેથી બ્રમ્પટનને તમામ ઉંમરના અને શક્તિ ધરાવતા લોકો માટે વધારે સુલભ બનાવી શકાય. હું RHFAC રેટિંગ મેળવવા આ મફત તકનો લાભ લેવા બધાં પ્રકારની સંસ્થાઓને પ્રોત્સાહિત કરું છું. અશક્તતા ધરાવતા લોકો માટે અવરોધો હટાવીને, તેઓને આપણાં સમુદાયમાં સંપૂર્ણપણે સહભાગી થવા દઈને, આપણું શહેર બધાં લોકો માટે વધારે સર્વગ્રાહી અને સુલભ બને છે.”

- પેટ ફોર્ટિની (Pat Fortini), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 7 અને 8; સભ્ય, એક્સેસિબિલિટી એડવાઈઝરી કમિટી; સભ્ય, રીજીયન ઓફ પીલ એક્સેસિબિલિટી એડવાઈઝરી કમિટી

“ઓન્ટેરિયો સરકારનું આ ઉદાર ભંડોળ ઘણી સંસ્થાઓને પોતાની ઇમારતની એક્સેસિબિલિટી સમજવામાં અને પ્રદર્શિત કરવામાં, અને નિર્મિત પર્યાવરણના સંદર્ભમાં તેઓની ભાવિ પ્રવેશ યોગ્યતા યોજનાઓ જાણાવવામાં મદદરૂપ થવામાં સક્ષમ બનાવશે. આ સંસ્થાઓ માટે આપણી વયોવૃદ્ધ થતી વસ્તી અને અશક્તતા ધરાવતા લોકોની વધતી જતી સંખ્યા માટે ઓન્ટેરિયોને વધારે સર્વગ્રાહી બનાવવામાં મદદરૂપ થવા માટે એક ચરિયાતી તક છે.

- બ્રેડ મેકનેલ (Brad McCannell), ઉપ-પ્રમુખ, એક્સેસ એન્ડ ઇન્ક્લુઝન, રિક હેન્સેન ફાઉન્ડેશન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca